

સાઉથ ઝોન (ઉધના) (એ)  
સુરત મહાનગરપાલિકા

હોદ્દો

એરીશનલ સીટી ઈજનેર (સીવીલ)  
અને ઝોનલ ચીફશ્રી

જોખ ચાર્ટ /કામગીરીની વિગત

સાઉથ ઝોન (ઉધના) (એ) નાં તમામ ઈજનેરી ખાતા, આરોગ્ય વિભાગ અને તમામ વહીવટી ખાતાની કામગીરી ઉપર દેખરેખ રાખવી અને તાબા હેઠળનાં સ્ટાફ મારફત કામગીરી કરાવવી.

આસી.કમિશનરશ્રી

સાઉથ ઝોન (ઉધના) (એ) નાં વહીવટી વિભાગનાં વડા તરીકે ફરજ બજાવવી, જેમાં સાઉથ ઝોન (ઉધના) (એ) નાં ઈજનેરી વિભાગ તથા આરોગ્ય વિભાગ સિવાયની તમામ વિભાગ જેવાકે, આકારણી વિભાગ, પ્રોફેશનલ ટેક્સ , લીગલ (કાયદાકીય) વિભાગ, વહીવટી વિભાગ / ગુમાસ્તાધારા વિભાગ, હિસાબી વિભાગ, મહેકમ વિભાગની તમામ કામગીરી ઉપર દેખરેખ રાખવી અને તાબા હેઠળનાં સ્ટાફ મારફત કામગીરી કરાવવી તથા જમીન મિલકત ખાતાને લગતી તમામ પ્રકારની રીકવરીને લગતી કામગીરી. જેમકે, ઈ.ડબલ્યુ.એસ. ઈન્સ્ટોલમેન્ટ, ભાડે પડે આપેલ મિલકતોને લાગત (પ્રિમિયમ વસુલાત) ભાડા પણાની આવકની કામગીરી, પે એન્ડ પાર્કિંગ, નાઈટ શેલ્ટર (રેનબસેરા), વિગેરે તથા પી.જી. પોર્ટલની ફીરિયાદની નિકાલની કામગીરી, આર.ટી.આઈ.—અપીલ અધિકારી તરીકેની કામગીરી

કાર્યપાલક ઈજનેરશ્રી

ટી.પી.ઓનાં ઈજનેરી વિભાગની તમામ કામગીરી કરાવવી.

- ૮૦ કુટ કે તેથી મોટા રસ્તાને કારપેટ રીકારપેટ કરવાનું કામ.
- ૮૦ કુટ કે તેથી નાના રસ્તાને કારપેટ રીકારપેટ કરવાનું કામ.
- ઝોનનાં વિસ્તારમાં લાગત તમામ નવા રસ્તા બનાવવા, પહોળા કરવા, રસ્તાની દુરસ્તી, રીકાર્પેટીંગ વિગેરે લોકફાળો લઈને સોસા.ના રસ્તા બનાવવાનું કામ, સોસા.ના રસ્તાઓ પર નવા કુટપથ બનાવવા, મરામત કરવા, સ્કેપીંગ , સ્ટ્રીટલાઇટ પોલ ઉભા કરીને કાર્યરત કરવાનું કામ વિગેરેની કાર્યવાહી કરવામાં આવે છે.
- પાલિકાના નવા મકાનો બાંધવા તથા ભ્યુ.મિલકતોનો નિભાવ કરવો.
- શાળાના મકાનો બાંધવા અને નિભાવ કરવો.
- ૧/૨ ' ઘર વપરાશ હેતુના તથા ૧ ' ના ઈન્ડ.કનેક્શન મંજુર કરવા તથા સોસા.ના આંતરીક રસ્તા ઉપર પાણીની નણીકા નાંખવી.
- ૨૨ ' સુધીની પાણીની મુખ્ય નણીકાઓની દુરસ્તી.
- ગેરકાયદેર પાણીના કનેક્શનનોના જોડાણ સામે કાયદેસરની કાર્યવાહી, દુષીત પાણીના જોડાણોની દુરસ્તી.
- સ્ટેન્ડ પોસ્ટ, ફી પાણીના કનેક્શન, હેન્ડ પંપ, ગટર જોડાણની પરવાનગી આપવી.
- નવી વરસાદી ગટરો બાંધવી અને મેટ્ન્ટેઇન કરવી.
- કાચી / પાકી ગટરોનો નિભાવ / સફાઈ કામગીરી, ચણતરની પાકી ગટર બાંધવી.
- નવા વધારાના કેચપીટ મારફત વરસાદી પાણીનો નિકાલ.
- પદ્ધતા જુપડપટ્ટી વિસ્તારના રસ્તા, પેવીંગ, લાઇટ, મફત જાજુ, ચોકરી, નવા કનેક્શનની સુવિધા આપવી.
- નવા તથા સુધારા વધારાના રેસી. બાંધકામ માટેની વિકાસ પરવાનગીની અરજીઓની ચકાસણી કરીને મંજુરી આપવી.
- ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવી.
- ટાઉન પ્લાનીંગ સ્કીમનું અમલીકરણ બેટરમેન્ટ ચાર્જિસ વસુલાત.
- જાહેર ન્યુસન્સ અને બિસ્માર મિલકત અંગે પગલા લેવા.
- મંડપ, બેનર, હોર્ડિંગ મોબાઇલ ટાવરની પરવાનગી આપવી.
- કાયમી, હંગામી, દબાણો દુર કરવા નડતરરૂપ જુપડાઓની વૈકલ્પિક વ્યવસ્થા કરવી.
- લો રાઈઝ રેસી. બાંધકામ કરવાની મંજુરી આપવામાં આપવી.
- સોસા.ઓનો લોકફાળો વસુલ લઈ ડ્રેનેજ લાઈન નાંખવી.
- પુર કે અન્ય કુદરતી આફતો વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.
- આર.ટી.આઈ – અપીલ અધિકારી તરીકેની કામગીરી.
- સબ ઝોન વિસ્તારમાં કાર્યક્ષેત્ર હેઠળનાં તમામ આસી./ જુની.ઇજનેરોને સોંપવામાં આવેલ વિવિધ ખાતાઓને લગતી કામગીરીનું સુપરવિઝન તેમજ સંકલનની કામગીરી.
- વધુમાં કાર્યપાલક ઈજનેરશ્રી તરફથી જે તે સમય સંજોગો પરિસ્થિતિને અનુરૂપ સોંપવામાં આવતી કામગીરી, ભુક્ંપ, ભારે વરસાદ જેવી આફતોનાં પ્રસંગે ડીઝાસ્ટર મેનેજમેન્ટનો અમલ અને રાહતને લગતી કામો.
- નવરાત્રીને લગતી જાહેર કામો રેલ રાહતને લગતી કામો
- ટેકનીકલ ખાતાના કર્મચારીઓનું અઠવાડિક ચેકીંગની કામગીરી, મહિનામાં એકવાર આરોગ્ય ખાતામાં જુદા જુદા ઝોનમાં રાત્રિ સ્કેપીંગ/ બ્રશીંગની કામગીરીનું સુપરવિઝન,
- પોતાના હાથ નીચેનાં કર્મચારી / કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ.
- જાહેર માહિતી અધિકારી તરીકેની ફરજ

૩.ઇજનેર

**રસ્તા વિભાગ**  
આસી./ જુની.ઈજનેર

- નવા રસ્તા મેટલ ગ્રાઉટીંગ, કારપેટ / રીકારપેટ કરવાના કામનાં અંદાજ તૈયાર કરવા, ટેન્ડર કામગીરી તથા સ્થળ પર રસ્તા બનાવવાનાં કામનું સુપરવિઝન.
- હયાત રસ્તાનાં મરામત / નિભાવની કામગીરી.
- નવા કુટપાથ બનાવવાનાં અંદાજ / ટેન્ડરની કામગીરી તથા સુપરવિઝન.
- રોડ મટીરીયલ્સ સપ્લાયની કામગીરી
- રસ્તા સંબંધી આવેલ ફરિયાદનાં તુમારનાં નિકાલની કામગીરી
- થયેલ કામોનાં બીલ બનાવવા, ઓડિટ ઓફિશનનાં નિકાલની કામગીરી
- વોર્ડ સમિતિને લગતી કામગીરી
- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી/કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન
- હાજરી નિયંત્રણ.
- રસ્તા વિભાગનાં મદદનીશ માહિતી અધિકારી તરીકેની ફરજ

**પાણી વિભાગ**  
આસી./ જુની.ઈજનેર

- ઝોન વિસ્તારનાં સોસાયટી, ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાણીની નજિકા નાંખવાનું કામ.
- લીકેજ દુરસ્ત તેમજ ગંદા પાણીના નિકાલની કામગીરી
- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન
- હાજરી નિયંત્રણ.
- પાણી વિભાગનાં મદદનીશ માહિતી અધિકારી તરીકેની ફરજ

**હાઉસીંગ વિભાગ**  
આસી./ જુની.ઈજનેર/  
સુપરવાઈઝર

- ઝોન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની મિલકતોનાં બાંધકામ, અંદાજ બનાવવાની કામગીરી, ટેન્ડરની કામગીરી, ચાલુ કામો પર દેખરેખ, સુરત મહાનગરપાલિકાની માલિકીની મિલકતોની નિભાવની કામગીરી
- કાગળોનાં પત્રવ્યવહારની કામગીરી
- વિવિધ પ્રસંગોની ઉજવણી/આયોજીત પ્રસંગે જરૂરી કામયાદ વ્યવસ્થા કરવાની કામગીરી
- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ/ સુપરવિઝન
- હાજરી નિયંત્રણ.
- હાઉસીંગ વિભાગનાં મદદનીશ માહિતી અધિકારી તરીકેની ફરજ

**જમીન મિલકત વિભાગ**  
જુની./આસી.ઈજનેર

- હોડીંગ તથા મોબાઇલ ટાવરની મહાનગરપાલિકાની જગ્યા તેમજ પ્રાઈવેટ જગ્યાઓ પર તાંત્રીક મંજૂરી આપવાની કામગીરી.
- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન
- હાજરી નિયંત્રણ.

**ડ્રેનેજ વિભાગ /સ્ટ્રોમ ડ્રેનેજ  
વિભાગ**

આસી./ જુની.ઈજનેર/  
સુપરવાઈઝર

- સમગ્ર ઝોન વિસ્તારનાં ડ્રેનેજ/સ્ટ્રોમ ડ્રેઇન લાઈનોનાં અંદાજો બનાવવા
- ટેન્ડરો મંગાવવા, મંજૂર કરાવવા, કોન્ટ્રાક્ટ સૌંપી સ્થળ કામગીરીનું સુપરવિઝન, માપણી, રનીગ તથા ફાઈનલ બીલો બનાવવા, સમગ્ર ઝોન વિસ્તારમાં મિલકતોનાં ડ્રેનેજ કનેક્શનની મંજૂરી આપવી,
- ડ્રેનેજ/સ્ટ્રોમ ડ્રેનેજને લાગત ઓડીટ વાંધાઓનો નિકાલ, સીક્યોરીટી ડીપોઝીટ છુટી કરવા સુધીની તમામ કાર્યવાહી કરવાનું તમામ પ્રકારની માહિતી આપવાનું, આ તમામ સ્ટોર્મ તથા સુઅર ડ્રેઇન લાઈનોનાં મરામત નિભાવની કામગીરી જેવી કે રીપેરીંગ, લાઈનોની સાફ્-સફાઈ (ડીસલ્ટીંગ), રીવર ફલડ જોટોનાં ઓપરેશન મેઇનન્ટેનન્સની કામગીરી, પાણીનાં ભરવા/ લાઈનો ચોકઅપ થવાનાં પ્રસંગે ડીવોટરીંગ પંપો ચલાવવાની તથા નિભાવણીની કામગીરી, જાળીયા તથા મેનહોલ ખરીદવા, સાફ કરવવા વિગેરે તમામ કામગીરી.
- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી/કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન
- હાજરી નિયંત્રણ.
- ડ્રેનેજ/સ્ટ્રોમ ડ્રેનેજ વિભાગનાં મદદનીશ માહિતી અધિકારી તરીકેની ફરજ

**લાઈટ વિભાગ**  
આસી. ઈજનેર(ઈલે.)/  
જુની.ઈજનેર(ઈલે.)

- સમગ્ર ઝોન વિસ્તારની સ્ટ્રીટ લાઈટોની મરામત, નિભાવની કામગીરીનું દેખરેખ તથા નવા સ્ટ્રીટ લાઈટ પોલ ઉભા કરવાના કામે અંદાજો રજુ કરાવવા
- કોન્ટ્રાક્ટથી કામ સૌંપી સ્થળ ઉપર સુપરવિઝન તથા એનજી બીલોની ચૂકવણી તથા મ્યુ. મિલકતોનાં વિદ્યુતને લાગત મરામત નિભાવ સહિતની કામગીરી.
- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ/સુપરવિઝન
- હાજરી નિયંત્રણ.
- લાઈટ ખાતાનાં મદદનીશ માહિતી અધિકારી તરીકેની ફરજ

શહેર વિકાસ વિભાગ  
આસી./ જુની.ઈજનેર/  
સુપરવાઈઝર

- સાઉથ ઝોન વિસ્તારમાં વિકાસ પરવાનગીની ફાઈલો મંજુર કરવી.
- સમયાંતરે મુખ્ય કચેરી, સરકારી તથા અન્ય કચેરીએથી માંગવામાં આવતી માહિતી આપવી/ સંકલન કરવું,
- ગેરકાયદેસર બાંધકામને નોટીસ આપી, તોડવા,
- મંજુર પ્લાન મુજબ-માર્ગદર્શન,
- ટેમ્પરરી સ્ટ્રક્ચરો – (મેળા, ફટાકડા, જાહુગર, નવરાત્રી આયોજન, લેબર ટેમ્પ વિગેરે)ને મંજુરી આપવી,
- ભયજનક /બિસમાર મિલકતોને આઈડેન્ટીફાઈ કરી, નોટીસ આપી, ઉતારી લેવાની કામગીરી,
- B.U.C. આપવાની કામગીરી,
- ટી.પી. સ્કીમનું અમલીકરણ
- રોડ, રસ્તાનું રીમાર્કેશન
- ટાઉન પ્લાનીગ એક્ટ મુજબ નોટીસ આપી રસ્તાની જગ્યાને કબજો મેળવવો,
- રીજર્વેશન પ્લોટની સાચવણી, રીમાર્કેશન, બોર્ડ મારવા, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવી,
- ડેવલપમેન્ટનાં રીજર્વેશન પ્લોટમાં દ્બાષ / ગેરકાયદેસર બાંધકામ ન થાય તેનાં પગલાં લેવા,
- ઈમ્પેક્ટ ફી ની વસુલાત, C.O.R., ની કામગીરી
- લારી-ગલ્લા, દ્બાષ દુર કરવા,
- જાહેર જનતાની વિવિધ મિલકતોની ટાઉન પ્લાનીગ તથા શહેર વિકાસને લગતા મુદ્દાઓની પુછીતાણનો નિકાલ, પ્રિલીમનરી / ફાયનલ ટી.પી. સ્કીમનાં રીજર્વ પ્લોટમાં દ્બાષકર્તાઓની વ્યક્તિતગત નોટીસ તૈયાર કરી, રીજર્વ પ્લોટનાં કબજો મેળવવાની કાર્યવાહી.
- પોલીસ ચોકી, પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક, પીકઅપ સ્ટેન્ડનાં લોકેશન – રીમાર્કેટ કરવા.
- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિગ્રહન
- હાજરી નિયંત્રણ.
- શહેર વિકાસ ખાતાનાં મદદનીશ માહિતી અધિકારી તરીકેની ફરજ

#### દ્બાષ વિભાગ

સુપરવાઈઝર/ટેકનિકલ આસી.

- જાહેર રસ્તા પરનાં દ્બાષ દુર કરવાની તથા શહેર વિકાસ ખાતાનાં માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની કામગીરી તથા અધિકારીશ્રીઓની સુચનાઓનું વખતોવખત પાલન કરવાની કામગીરી.
- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ.

#### આરોગ્ય વિભાગ

નાયબ આરોગ્ય અધિકારી

- સમગ્ર ઝોનમાં આરોગ્યલક્ષી કામગીરીઓ અંગે તમામ વોર્ડ કચેરી તથા વાહક જનિત રોગ નિયંત્રણ યુનિટની કામગીરીનું સુપરવિગ્રહ અને વહીવટી કામગીરી.
- પોતાના હાથ નીચેના કર્મચારી/કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ.
- આરોગ્યલક્ષી બાબતોને લાગત ટેકનીકલ કામગીરીઓનું સંકલન
- સાફ સફાઈની કામગીરી
- જંતુનાશક દવાઓનો છંટકાવ
- ઘન કચરાનું એક્ટિવીકરણ, પરિવહન અને આખરી નિકાલ
- મરેલા જાનવરો (નાના અને મોટા)નો નિકાલ
- ધી જી.પી.એમ.સી. હેઠળનાં લાઇસન્સનાં રીન્યુઅલની કામગીરી
- ગલી-ટ્રેપ ચોકીગ દુર કરવાની કામગીરી
- ખાળુંબા સફાઈ, ગલી સફાઈ
- વપરાશી કૂવાનું કલોરિનેશન અને પાણીના નમુનાનાં કલોરીન ટેસ્ટ.
- ન્યુસન્સ કરનારા નાગરિકો સામે કાનુની પગલા ખાશી પીણીની હોટેલ, લારી ગલ્લા તેમજ તેવી અન્ય તમામ સંસ્થાઓમાં આરોગ્ય વિષયક તપાસની કામગીરી.
- જાહેર જાજરૂ/પિશાબદાનીની સફાઈની કામગીરી.
- જાહેર મનોરંજનનાં સ્થળો જેવા કે સિનેમા, નાટયગૃહો વિગેરેની આરોગ્ય વિષયક તપાસ.
- રોગચાળા અંગેની પ્રાથમિક માહિતી મેળવી ઉચ્ચ અધિકારીને તાકીદ જાણ કરવી તેમજ રોગ અટકાયત પગલાની કામગીરી.
- ઈ-ગવર્નન્સ, ક્રમલેઈન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ હથળનાં અમલીકરણની ફરિયાદ નોંધવાની કામગીરી.
- નાગરિક સેવાને લગતી ફરિયાદો જેવી કે આરોગ્યને લગતી ફરિયાદોની ૨૪/૪૮ કલાકમાં નિકાલ કરવાની તથા ફરિયાદીને તેની જાણ કરવાની પ્રથા.
- નાગરિકોને મહાનગરપાલિકાના સંચાલન માટેની તમામ વિગતો ઉપલબ્ધ થઈ શકે તે માટે નાગરિક અધિકારપત્રનાં આરોગ્ય તથા જન્મ-મરણ વિભાગને લાગત વિગતો ઉપલબ્ધ રાખવી.
- દરેક વોર્ડ વાઈઝ રોજ રોજ પાણીનાં નમુના બેક્ટોરીયોલોજીકલ / કેમીકલ ટેસ્ટ માટે મેળવી તેનું પુષ્ટકરણ કરી ગંદા પાણીની ફરીયાદોનાં અનુસંધાનમાં આરોગ્ય વિષયક કામગીરી
- આર.ટી.આઈ – અપીલ અધિકારી તરીકેની કામગીરી.
- સમગ્ર ઝોન વિસ્તારમાં આરોગ્યલક્ષી તમામ કામગીરી કરાવવાની.
- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિગ્રહન
- હાજરી નિયંત્રણ.

ચીફ એસ.આઈ.

- સાફ સફાઈની કામગીરી
- જંતુનાશક દવાઓનો છંટકાવ
- ઘન કયરાનું એક્ટ્રિકરણ, પરિવહન અને આખરી નિકાલ
- મરેલા જાનવરો (નાના અને મોટા)નો નિકાલ
- ધી બી. પી. એમ. સી. હેઠળનાં લાઈસન્સનાં રીન્યુઅલની કામગીરી
- ગલી-ટ્રેપ ચોકીગ દુર કરવાની કામગીરી
- ખાળુંબા સફાઈ, જાહેર જાજરુ સફાઈ, ગલી સફાઈ, વપરાશી કૂવાનું કલોરિનેશન અને પાણીના નમુનાના કલોરીન ટેસ્ટ, ન્યુસન્સ કરનારા નાગરિકો સામે કાનૂની પગલા
- ખાણી પીણીની હોટેલ, લારી ગલ્લા તેમજ તેવી અન્ય તમામ સંસ્થાઓમાં આરોગ્ય વિષયક તપાસની કામગીરી જાહેર જાજરુ / પિશાબદાનીની સફાઈની કામગીરી.
- જાહેર મનોરંજનનાં સ્થળો જેવા કે સિનેમા, નાટ્યગૃહો વિગેરેની આરોગ્ય વિષયક તપાસ
- રોગચાળા અંગેની પ્રાથમિક માહિતી મેળવી ઉચ્ચ અધિકારીને તાકીદે જાણ કરવી તેમજ રોગ અટકાયત પગલાની કામગીરી.
- ઈ- ગવર્નન્સ, કમ્પલેઇન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ હેઠળનાં અમલીકરણની ફરિયાદ નોંધવાની કામગીરી.
- નાગરીક સેવાને લગતી ફરિયાદો જેવી કે આરોગ્યને લગતી ફરિયાદોની ૨૪/૪૮ કલાકમાં નિકાલ કરવાની તથા ફરિયાદીને તેની જાણ કરવાની પ્રથા
- નાગરિકોને મહાનગરપાલિકાના સંચાલન માટેની તમામ વિગતો ઉપલબ્ધ થઈ શકે તે માટે નાગરિક અધિકારપત્રનાં આરોગ્ય વિભાગને લાગત વિગતો ઉપલબ્ધ રાખવી.
- દરેક વોર્ડ વાઈજ રોજેરોજ પાણીનાં નમુના બેક્ટોરીયોલોજીકલ / કેમીકલ ટેસ્ટ માટે મેળવી તેનું પૃથ્વકરણ કરી ગંદા પાણીની ફરિયાદનાં અનુસંધાનમાં આરોગ્ય વિષય કામગીરી.
- જાહેર માહિતી અધિકારી તરીકેની ફરજ
- આરોગ્યલક્ષી તમામ કામગીરી કરાવવાની તથા યુનીટ ખાતેનાં કર્મચારીઓ પાસે વાહકજનિત રોગ નિયંત્રણ માટેની તમામ પ્રકારની કામગીરી કરાવવાની, રાત્રિ છેપીગ / બ્રશીગ કામગીરીનું સુપરવિઝન તેમજ વહીવટી કામગીરી
- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી/કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન
- હાજરી નિયંત્રણ
- સાફ સફાઈની કામગીરી
- જંતુનાશક દવાઓનો છંટકાવ
- ઘન કયરાનું એક્ટ્રિકરણ, પરિવહન અને આખરી નિકાલ
- મરેલા જાનવરો(નાના અને મોટા) નો નિકાલ
- ધી બી. પી. એમ. સી. હેઠળનાં લાઈસન્સનાં રીન્યુઅલની કામગીરી
- ગલી-ટ્રેપ ચોકીગ દુર કરવાની કામગીરી
- ખાળુંબા સફાઈ, જાહેર જાજરુ સફાઈ, ગલી સફાઈ
- વપરાશી કૂવાનું કલોરિનેશન અને પાણીના નમુનાનાં કલોરીન ટેસ્ટ
- ન્યુસન્સ કરનારા નાગરિકો સામે કાનૂની પગલા ભરવા.
- ખાણી પીણીની હોટેલ, લારી ગલ્લા તેમજ તેવી અન્ય તમામ સંસ્થાઓમાં આરોગ્ય વિષયક તપાસની કામગીરી
- જાહેર જાજરુ/પિશાબદાનીની સફાઈની કામગીરી
- જાહેર મનોરંજનનાં સ્થળો જેવા કે સિનેમા, નાટ્યગૃહો વિગેરેની આરોગ્ય વિષયક તપાસ
- રોગચાળા અંગેની પ્રાથમિક માહિતી મેળવી ઉચ્ચ અધિકારીને તાકીદે જાણ કરવી તેમજ રોગ અટકાયત પગલાની કામગીરી.
- ઈ-ગવર્નન્સ, કમ્પલેઇન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ હેઠળનાં અમલીકરણની ફરિયાદ નોંધવાની કામગીરી.
- નાગરીક સેવાને લગતી ફરિયાદો જેવી કે આરોગ્યને લગતી ફરિયાદોની ૨૪/૪૮ કલાકમાં નિકાલ કરવાની તથા ફરિયાદીને તેની જાણ કરવાની પ્રથા
- નાગરિકોને મહાનગરપાલિકાનાં સંચાલન માટેની તમામ વિગતો ઉપલબ્ધ થઈ શકે તે માટે નાગરિક અધિકાર પત્રનાં આરોગ્ય વિભાગને લાગત વિગતો.
- દરેક વોર્ડ વાઈજ રોજેરોજ પાણીનાં નમુના બેક્ટોરીયોલોજીકલ / કેમીકલ ટેસ્ટ માટે મેળવી તેનું પૃથ્વકરણ કરી ગંદા પાણીનાં અનુસંધાનમાં આરોગ્ય વિષયક કામગીરી.
- આરોગ્યલક્ષી તમામ કામગીરી તેમજ એ.આઈ.ઓ.શ્રી તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટરોનાં સલાહ સુચન મુજબ તમામ પ્રકારની કામગીરી, પ્રાયમરી હેલ્પ વર્કર તથા બેલદાર અને સફાઈ કામદારો પાસે લેવી.
- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ

#### આરોગ્ય નિરીક્ષક

- સાફ જંતુનાશક દવાઓનો છંટકાવ
- ઘન કયરાનું એક્ટ્રિકરણ, પરિવહન અને આખરી નિકાલ
- મરેલા જાનવરો(નાના અને મોટા) નો નિકાલ
- ધી બી. પી. એમ. સી. હેઠળનાં લાઈસન્સનાં રીન્યુઅલની કામગીરી
- ગલી-ટ્રેપ ચોકીગ દુર કરવાની કામગીરી
- ખાળુંબા સફાઈ, જાહેર જાજરુ સફાઈ, ગલી સફાઈ
- વપરાશી કૂવાનું કલોરિનેશન અને પાણીના નમુનાનાં કલોરીન ટેસ્ટ
- ન્યુસન્સ કરનારા નાગરિકો સામે કાનૂની પગલા ભરવા.
- ખાણી પીણીની હોટેલ, લારી ગલ્લા તેમજ તેવી અન્ય તમામ સંસ્થાઓમાં આરોગ્ય વિષયક તપાસની કામગીરી
- જાહેર જાજરુ/પિશાબદાનીની સફાઈની કામગીરી
- જાહેર મનોરંજનનાં સ્થળો જેવા કે સિનેમા, નાટ્યગૃહો વિગેરેની આરોગ્ય વિષયક તપાસ
- રોગચાળા અંગેની પ્રાથમિક માહિતી મેળવી ઉચ્ચ અધિકારીને તાકીદે જાણ કરવી તેમજ રોગ અટકાયત પગલાની કામગીરી.
- ઈ-ગવર્નન્સ, કમ્પલેઇન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ હેઠળનાં અમલીકરણની ફરિયાદ નોંધવાની કામગીરી.
- નાગરીક સેવાને લગતી ફરિયાદો જેવી કે આરોગ્યને લગતી ફરિયાદોની ૨૪/૪૮ કલાકમાં નિકાલ કરવાની તથા ફરિયાદીને તેની જાણ કરવાની પ્રથા
- નાગરિકોને મહાનગરપાલિકાનાં સંચાલન માટેની તમામ વિગતો ઉપલબ્ધ થઈ શકે તે માટે નાગરિક અધિકાર પત્રનાં આરોગ્ય વિભાગને લાગત વિગતો.
- દરેક વોર્ડ વાઈજ રોજેરોજ પાણીનાં નમુના બેક્ટોરીયોલોજીકલ / કેમીકલ ટેસ્ટ માટે મેળવી તેનું પૃથ્વકરણ કરી ગંદા પાણીનાં અનુસંધાનમાં આરોગ્ય વિષયક કામગીરી.
- આરોગ્યલક્ષી તમામ કામગીરી તેમજ એ.આઈ.ઓ.શ્રી તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટરોનાં સલાહ સુચન મુજબ તમામ પ્રકારની કામગીરી, પ્રાયમરી હેલ્પ વર્કર તથા બેલદાર અને સફાઈ કામદારો પાસે લેવી.
- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ

#### મદદનીશ આરોગ્ય નિરીક્ષક

- સમગ્ર ઝોન વિસ્તારમાં વાહકજનિત રોગ નિયંત્રણ અંગેની કામગીરીનું મોનીટરીંગ તેમજ સુપરવિઝન, સર્વેલન્સ (પેરા સાઈટોલોજીકલ મેઝર્સ, ઇન્ટ્રાડોમેસ્ટિક સર્વે) વિકલી એન્ટીલાર્વલ, એન્ટી એડલટ (ફોંગીગ IRS), હેલ્પ એજયુકેશન, ઇમ્પલીમેન્ટેશન ઓફ બાયલોજ વિગેરે કામગીરી
- પોતાના હાથ નીચેના કર્મચારી / કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ
- ઇન્ટ્રા. ડોમેસ્ટિક સર્વેલન્સ અંગેની કામગીરી તથા એન્ટીલાર્વલ અંગેની કામગીરી, ફોંગીગ અંગેની કામગીરી
- આરોગ્યલક્ષી તમામ કામગીરી

#### મુકાદમ

## ગુમાસ્તાધારા વિભાગ દુકાનધારા નિરીક્ષક

- મુંબઈના દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ ૧૯૪૮ માં જણાવ્યા મુજબની તમામ ફરજો બજાવવી જેવી કે, સંસ્થાની નોંધણી થયેલ છે કે કેમ? તેમજ સંસ્થામાં કામ કરતાં કર્મચારીઓનાં હાજરી પત્રક, પગાર પત્રક વિગેરેની તપાસ તેમજ સંસ્થાની અઠવાડિક બંધની તપાસ/રાની તપાસ કરવી તથા ધારાભંગની નામદાર મ્યુનિ.કોર્ટ માં ફરિયાદ દાખલ કરવી.
- બોંઘે લેબર વેલફેર ફંડ અધિનિયમ ૧૯૫૩ની અમલીકરણ કરાવવું.
- ગુજરાતના દુકાનો અને સંસ્થાઓના અધિનિયમોનાં નિયમ જોગવાઈઓનું અમલીકરણ કરાવવું.
- કર્મચારી જીવન વીમા અધિનિયમ ૧૯૮૦ ની જોગવાઈઓનું પાલન કરાવવું.
- ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધ્વા અને રોજગાર વેરા અધિનિયમ ૧૯૭૬ અમલીકરણ માટેની ફરજો બજાવવી અને વ્યવસાય વેરાને લગતી તમામ કામગીરી તથા વ્યવસાય વેરા / ગુમાસ્તાધારાની સાથે સંકળાયેલા સ્ટાફની કામગીરી પર સુપરવિઝન કરવું.

## આકારણી અને વસુલાત વિભાગ

### એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફિસર

- સુરત મહાનગરપાલિકાનાં વિસ્તારમાં આવેલ મિલકતોની સર્વેયર મારફત આકારણી દફતરે વેરાનાં હેતુ માટે એસેસમેન્ટ કરી ખાસ નોટીસ બજાવડાવવી તથા નોંધણી કરવી.
- આવી મિલકતો માટેનું એસેસમેન્ટ રજીસ્ટર, કટબુક રજીસ્ટર તથા તેને આનુસંધિક અન્ય રેકર્ડની જાળવણી કરવી/ કરાવવી.
- મિલકતોની આકારણી થયા બાદ તેના યોગ્ય તે સમયે વેરા માટેનાં બીલો તૈયાર કરવા તથા તે મ્યુનિસીપલ વેરાની રીકવરી કરવી.
- જો મિલકત વેરાની વસુલાત ન થાય તો જી.પી.એમ.સી. એકટની જોગવાઈ મુજબ નક્કી કરેલ સમય મર્યાદમાં નોટીસ, વોરંટની બજાવણી ત્યાર બાદ, મિલકતોની જપ્તી/ટાંચમાં લઈ વેરા વસુલાતની આગળની કાર્યવાહી કરવી.
- મિલકતોની થયેલ આકારણીનું રજીસ્ટર જાહેર જનતા માટે ખુલ્લું મુકવું અને તેમાં આવેલ વાંધાઓ એપેલેટ ઓફિસર ધ્વારા સુનાવણી કરવાની વ્યવસ્થા કરવી.
- એપેલેટનાં થયેલ હુકમનો અમલ કરવો. તેની ખાસ નોટીસ બજાવવી.
- વખતોવખત મિલકતોનાં માલિકો, ધારણકર્તાઓ, કબજેદારનાં નામ રજી કરેલ દસ્તાવેજી પુરાવાઓને આધિન આકારણી દફતરે ફેરફાર કરવા.
- અરજદાર તરફથી આવતી નવી મિલકત માટેની આકારણી કરવાનાં હેતુ સારુ આવતી અરજીઓ સ્વીકારી તેવી નવી / ફેરફાર થયેલ મિલકતોની આકારણી કરી આકારણી દફતરે ચઢાવી તેની રીવાઈજ નોટીસ આપી બીલ ઈસ્યુ કરવા.
- હોદ્દાની રૂએ વ્યવસાય વેરા અધિકારી તરીકેની ફરજો અદા કરવી.
- આર.ટી.આઈ. એકટ અન્વયે જાહેર માહિતી અધિકારી તરીકેની ફરજો અદા કરવી.

## કાયદા વિભાગ

### આસી.લો ઓફિસર અને એપેલેટ ઓફિસર

- સાઉથઝોનનાં વિવિધ ખાતા ધ્વારા માંગવામાં આવતા કાનુની અભિપ્રાય આપવાની કામગીરી
- એડવોકેટશ્રીનાં વકીલ ફી નાં બીલનાં વ્યાજબીપણાનાં અભિપ્રાયની કામગીરી
- ઝોનનાં કોર્ટ કેસો બાબતે જરૂરી કાનુની માર્ગદર્શન પૂરુ પાડવાની કામગીરી
- રીસ્ટ્રીક્ટ કોર્ટ કેસ, લેબર કોર્ટ કેસો, સીવીલ કેસોનું મોનીટરીંગની કામગીરી
- જરૂરીયાત જણાયે હાઈકોર્ટનાં એડવોકેટ સાથે ચર્ચા કરવા હાઈકોર્ટ/ગાંધીનગર જવાની કામગીરી
- મિલકતોની આકારણી અનુસંધાન થયેલ હરકત અરજી અંગેની કાર્યવાહી કરવા અંગેની કામગીરી
- કાયદા વિભાગનાં જાહેર માહિતી અધિકારી તરીકેની કામગીરી

## મહેકમ વિભાગ

### પસોનેલ ઓફિસર

- સમગ્ર ઝોનના વહીવટી અધિકારી તરીકેની કામગીરી
- આંતરીક ખાતાકીય તપાસને લગતી તમામ કામગીરી,
- મહેકમને લગતી તમામ કામગીરીનું નિયંત્રણ.
- તાબા હેઠળના કર્મચારીઓની કામગીરીનું અસરકારક નિયંત્રણ અને અન્ય વહીવટી કામગીરી.
- ઝોનનાં મહેકમ સંબંધિત બાબતે જાહેર માહિતી અધિકારી તરીકેની ફરજ અદા કરવી.

## જમીન મિલકત વિભાગ

### આસી. મેનેજર

- જુદા જુદા શોધીંગ સેન્ટરના ભાડા વસુલાત અંગેની કામગીરી
- ઈ.ડબલ્યુ.એસ. આવાસનાં હપ્તા વસુલાત અંગેની કામગીરી
- કોમ્પ્યુનીટી હોલનાં ભાડા વસુલાત અંગેની કામગીરી
- મંડપ-બેનર પરમીશન અંગેની વસુલાત અંગેની કામગીરી
- ભુગર્ભ પાઈપ લાઈનનાં ભાડા વસુલાત અંગેની કામગીરી
- સુરત મહાનગરપાલિકાની મિલકત તથા પ્રાઈવેટ મિલકતો પર હોર્ડિંસ તથા ટાવરના ભાડા વસુલાત અંગેની કામગીરી

## હિસાબી વિભાગ

### ડે.એકાઉન્ટન-

- હિસાબોને લગતી તમામ કામગીરી,
- બજેટ, જનરલ એડવાન્સ, ડીપોઝીટ, આવક-ખર્ચને લગતી તમામ કામગીરી,
- ઓડિટ ઓફ્જેક્શનનો નિકાલ,
- રીક્વુપમેન્ટની કામગીરી,
- પોતાના હાથ નીચેના કર્મચારી / કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ.
- હિસાબી ખાતાના બીલ તથા વહીવટી વિભાગમાં કામગીરી કરતા કર્મચારીની વિગત.
- આર.ટી.આઈ. એકટ અન્વયે જાહેર માહિતી અધિકારી તરીકેની ફરજો અદા કરવી

(1) પ્રથમ શ્રેણી કલાર્કની કામગીરી

1. એમ.બી. સિવાયનાં ઈલેક્ટ્રોનિક કંપની, જી.ઇ.બી., સોસાયટી અનુદાનનાં બીલો, સો.સા.રીફ્ડ બીલો, EMD \SD\SC રીફ્ડ તથા અન્ય તમામ પ્રકારનાં રીફ્ડ બીલોની ચકાસણી કરવી તથા તેની ડબલ એન્ટ્રી કરી પેમેન્ટ ઓર્ડર કરવા.
2. સરકારી – અર્ધસરકારી સત્તરે માંગવામાં આવતી વિવિધ પ્રકારની માહિતીઓનું સંકલન કરી / તૈયાર કરી લાગત જગ્યાએ પાઠવવાની કાર્યવાહી કરવી.
3. કેપીટલ ખર્ચના રીકન્સીલેશનની કાર્યવાહીમાં ચેકીગ કલાર્કને મદદ કરવી તથા ઈપોઝીટ ખર્ચનાં રજીસ્ટરોનું ડીસ્પેચ કલાર્ક સાથે સંકલનમાં રહીને રીકન્સીલેશન કરાવું.
4. ફીક્ષ એસેટસના પત્રકોનું હિસાબી શાખા સાથે ચેકીગ કલાર્કની સાથે સંકલનમાં રહીને રીકન્સીલેશન કરાવું.
5. પુરક બજેટ / વાર્ષિક બજેટ તૈયાર કરવું.
6. ઓડિટ ઓફ્ઝેક્શન વિષયક તમામ કામગીરી કરવી.
7. સ્ટોર એકાઉન્ટનું પોસ્ટીગ કરાવી લાગત સ્ટોક ખાતેથી માહિતીઓ મેળવી મુખ્ય હિસાબી કરેંચી સાથે રીકન્સીલેશન કરવું.
8. ચેકીગ કલાર્ક ડબલ એન્ટ્રી કર્યા બાદ તમામ પ્રકારના (M.A.COD) બીલનું ચેકીગ કરવું.
9. ડિસ્પેચ કલાર્ક તરીકે પત્ર વ્યવહાર તથા અન્ય કામગીરીઓ કરવી.

(2) ચેકીગ કલાર્કની કામગીરી (દ્વિત્ય શ્રેણી)

1. પ્રથમ શ્રેણી કલાર્કને સૌંપેલ સિવાયના તમામ પ્રકારનાં રેવન્યુ તથા કેપીટલ કામોના બીલોની સંપૂર્ણ ચકાસણી કરવી તથા એમ.બી. માં પેમેન્ટ અંગે નોંધ કરવી.
2. હિસાબી શાખામાં બીલો મોકલતા પહેલા તમામ બીલોની ડબલ એન્ટ્રી / ચેકીગ કરી પેમેન્ટ ઓર્ડરનાં શેરા મારવા.
3. જનરલ એડવાન્સ ખર્ચ તથા રિકુપમેન્ટ બીલો બનાવવા તથા જન.એડવાન્સનું રીકન્સીલેશન કરવું.
4. કેપીટલ કામોનાં ખર્ચાઓનું રીકન્સીલેશન કરવું.
5. મ્યુ.સભ્યો / ધારાસભ્યો / સાંસદ સભ્યો તેમજ અન્ય પ્રકારની ગ્રાંટનાં રજીસ્ટર નિભાવવા તથા આનુસંધીક માહિતીઓ કરવી.
6. હિસાબી વિભાગમાં આવતા તમામ બીલ, એમ.બી.પત્ર વ્યવહાર વિગેરે સ્વીકારી ઈનવર્ડ કરવા અંગેની કામગીરી કરવી.
7. વાર્ષિક બજેટ તૈયાર કરવામાં હેડ કલાર્કને મદદ કરવી.

(3) બીલ કલાર્કની કામગીરી (દ્વિત્ય શ્રેણી)

1. રેવન્યુ તથા કેપીટલ ખર્ચ રીફ્ડ તેમજ અન્ય તમામ પ્રકારના બીલો તૈયાર કરવાની કામગીરી કરવી.
2. ડીસ્પેચ કલાર્ક સાથે સંકલનમાં રહી તમામ પ્રકારના ખર્ચ રજીસ્ટરો / ઈપોઝીટ ખર્ચ રજીસ્ટરો મેઈન્ટિન કરાવવા તથા ખર્ચ વિષયક માહિતીઓ સમયાંતરે તૈયાર કરવી.
3. રેવન્યુ ખર્ચના રજીસ્ટરોનું ડીસ્પેચ કલાર્ક સાથે સંકલનમાં રહી હિસાબી કરેંચી સાથે રીકન્સીલેશન કરવું.
4. હિસાબી વિભાગનાં તેમજ વિવિધ દફ્તરોને કોમ્પ્યુટરાઇઝ કરવા અંગેની કામગીરી તાકીદે પુરી કરવી.
5. ડીસ્પેચ કલાર્કની ગેરહાજરીમાં બીલ ડીસ્પેચ કરવા અંગેની કામગીરી કરવી.
6. વાર્ષિક બજેટ તૈયાર કરવામાં હેડ કલાર્કને મદદ કરવી

(4) ડીસ્પેચ કલાર્કની કામગીરી (ત્રીજી શ્રેણી)

1. તમામ પ્રકારના ખર્ચ રજીસ્ટરો નિભાવવા તથા રેવન્યુ ખર્ચનું રીકન્સીલેશન કરવામાં બીલ કલાર્કને મદદ કરવી.
2. વિવિધ પ્રકારના ડીપોઝીટ રીફ્ડ (ખર્ચ) રજીસ્ટરો નિભાવવા તથા તેનું રીકન્સીલેશન કરવું.
3. તૈયાર કરેલા બીલોનું ડીસ્પેચ કરવું તથા બીલોની ઓસી. અને ફિક્ષ એસેટસના પત્રકો ફાઈલીગ કરવા.
4. ઝોનમાં આવતા હિસાબી ખાતાને લાગત તમામ પ્રકારનાં પત્ર વ્યવહારોનું વર્ગીકરણ મુજબ ફાઈલીગ કરવું.
5. ઓડિટ રજીસ્ટરો નિભાવવાની કામગીરીમાં હેડ કલાર્કને મદદ કરવી. હિસાબી ખાતાના કેશ વિભાગમાં કામ કરતા કર્મચારીઓને મદદ કરવી.

(1) પ્રથમ શ્રેણી કલાર્કની કામગીરી (હેડ કેશીયર)

1. કેશીયર સ્લીપ તૈયાર કરવી અને ભરણા સ્વીકારવા.
2. બેંક સ્લીપ વાઉચર, કેશ રીશીપ્ટ વાઉચર, કેશ પેમેન્ટ વાઉચર તથા ઓવર ઓલ રીપોર્ટ તૈયાર કરવા.
3. રીકન્સીલેશનની કામગીરીમાં મદદ કરવી.
4. મુખ્ય કરેંચીએ ડે-બુકમાં આવક-જાવકની નોંધ કરવી.
5. ઓડિટ ઓફ્ઝેક્શનના નિકાલમાં મદદ કરવી.
6. બેંક સાથે ચાર્જિસ બાબતે યોગ્ય કામગીરી કરવી.

7. ઝોનની બુકમાં આવક – ખર્ચની માહિતીની નોંધણી કરવી તેમજ ડે-બુક તૈયાર કરવી.
8. ઓપરેટીવ અને નોન ઓપરેટેટીવ એકાઉન્ટના બેંક રીકન્સીલેશનની કામગીરી કરવી.
9. હેડ કેશીયરની રજા દરમાનની તમામ કામગીરી કરવી.

10. ઓડિટ ઓફ્ઝેક્શનના નિકાલમાં મદદ કરવી.

(2) જુની. કલાર્ક(ત્રીજી શ્રેણી)

1. જુદા જુદા વોર્ડ માંથી આવતી રોકડ જમા લેવી.
2. સીધાવેરા – વ્યવસાયવેરા વિભાગની રોકડ તથા ચેક જમા લેવા.
3. ઉપરોક્ત બંને વિભાગની જનરલ વાઉચર અને બેંકનું રીસીપ્ટ વાઉચર તૈયાર કરવા.
4. જનરલ આવકની નોંધ રજીસ્ટરમાં રાખવી.
5. બેંકમાં કેશ તેમજ ચેક જમા કરાવવામાં યોગ્ય મદદ કરવી.

## સેક્શન ઓફિસર

- કર્મચારીઓ નિયમીત ફરજ પર હાજર રહે છે કે નહિ તેનું નિયંત્રણ.
- તાબા હેઠળનાં કર્મચારીઓ પાસેથી લાગત ખાતા સંબંધિત લેવાની કામગીરી,
- ગર્વમેન્ટ તરફથી માંગ્યા મુજબની માહિતી નિયમીત જાય છે કે નહિ તે જોવું,
- સેક્શનમાં દરેક દફતરોને લગતી જવાબદારી તથા અન્ય સુપરવાઈઝિંગ પ્રકારની કામગીરી,
- મહેકમને લગતી તમામ કામગીરી,
- ઝોનનાં વહીવટને લગતી કામગીરી અને જુદા જુદા ખાતાઓની માહિતીઓનાં સંકલનની કામગીરી
- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન
- હાજરી પત્રકની નિભાવણી.

## પ્રથમ શ્રેણી કલાર્ક

- સંબંધિત ખાતાનાં મદદનીશ માહિતી અધિકારી તરીકેની ફરજ અદા કરવી.
- ઓડિટ ઓફિશનનો નિકાલ કરવાની કામગીરી,
- હેડ કલાર્ક તરીકેની ફરજો અદા કરવી.
- આ કામગીરી જે તે ખાતાવાર અલગ અલગ પ્રકારની આ ઉપરાંત ખાતાનાં વડા અધિકારી સોંપે તે કામગીરી કરવાની રહે છે.
- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીની કામગીરી / હાજરીની કામગીરીની ચકાસણી તથા વર્તણું કબાબતે અસરકારક સુપરવિઝનની કામગીરી.

## બીજી શ્રેણી કલાર્ક

- જે તે ખાતામાં સોંપવામાં આવતી ખાસ પ્રકારની જવાબદારીઓ જેવી કે, સભ્યશ્રીઓ તરફથી સ્ટેન્ટીંગ કમીટી, સામાન્ય સભામાં પુછ્છવામાં આવતા સવાલોનાં જવાબો તૈયાર કરવાની કામગીરી.
- આમ, દરેક ખાતા પ્રમાણે કામગીરીમાં ફેરફાર રહે છે.
- સંબંધિત ખાતાનાં કેશ કાઉન્ટરની કામગીરી,
- ડેઝુક, રીટર્ન યોક, શિક્ષણ ઉપકર, કુરીયરની કામગીરી,
- સર્વેયરની કામગીરી, તુમાર તૈયાર કરવા
- સ્ટોર વિભાગની કામગીરી,
- રાઇટ ટુઝન્ઝોર્મેશન એકટ હેઠળની માહિતી ઉપલબ્ધ કરવી.
- ગુમાસ્તા વિભાગ / પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવવાની કામગીરી
- રેકર્ડની કામગીરી પર દેખરેખ રાખવી, રેકર્ડ એ, બી, સી, ડી, વાઈજ રેકર્ડ ગોઠવવો
- જમીન મિલકત વિભાગ ધ્વારા ઝોન વિસ્તારમાં ડે.ઈજનેરશ્રીની સુચના મુજબ મહાનગર પાલિકાનાં સામાજિક સુવિધા આપવાનાં હેતુ માટે નડતરરૂપ ઝુંપડપટ્ટીનાં સર્વેની કામગીરી
- એસ્ટાફ્લીસ્ટમેન્ટ તથા ઈન્ક્વાયરી કલાર્ક તરીકેની કામગીરી.
- ફર્સ્ટ ગ્રેડ કલાર્કની ગેરહાજરીમાં તેમને સોંપવામાં આવેલ કામગીરી.

## ત્રીજી શ્રેણી કલાર્ક

- જાહેર જનતા તરફથી આવતી અરજીઓ સ્વીકારી તેની પહોંચ આપવાની કામગીરી એટલે કે ઈનવર્ડ, આઉટવર્ડ એમ બંને પ્રકારની કામગીરી, જે તે ખાતામાંથી આવતા પત્રનો નિકાલ વિગેરે કામગીરી,
- ટેન્ડર કલાર્કની કામગીરી,
- ફિલ્ડખુક કલાર્કની તેમજ વૉર્ડ ઈન્સ્પેક્ટરની કામગીરી,
- જન્મ-મરણ-લગ્ન નોંધણીની કામગીરી, રેકર્ડની કામગીરી સીવીક સેન્ટર કેશ કલેક્શન,
- હરકત અરજીનાં રીપોર્ટ રજુ કરવા તથા સ્થળ તપાસની કામગીરી
- જમીન મિલકત ખાતાને લગતી જેવી કે ટેનામેન્ટનાં સ્થળ પર હપ્તા વસુલાત, મહાનગરપાલિકાનાં શોપીંગ સેન્ટરનાં ભાડા વસુલાત, મંડપ ફી, ઈલક્ટ્રોનિક સબ-સ્ટેશન જમીન ભાડા, હૃદ સહકારી મંડળીનાં તેપોનાં જમીન ભાડા, ખાનગી સર્વીસ પ્રોવાઈડર કંપનીઓની લાઈન/કેબલવનાં ભાડા, સુ.ડી.ટેલીફોનને ફણવેલ જગ્યાનાં ભાડા વસુલાત, લાગત સ્કુલ ભાડા, પે એન્ડ યુઝ ટોયલેટનાં ભાડા, હોકીગ, અપંગ તથા વિધવાઓને ફણવેલ જગ્યાના ભાડા વગેરે વસુલાતની કામગીરી, આવેલ અરજીઓ અંગે સ્થળ તપાસ અને નિકાલ તેમજ ઉપરોક્ત સમગ્ર કામગીરીઓને લગતી આનુસાંગિક પેપર વર્ક કામગીરી વગેરે.

## સામાન્ય બાબત

સુરત મહાનગરપાલિકાનો સમગ્ર વહીવટ અને કામગીરી અલગ અલગ ખાતાઓમાં વહેચાયેલ છે જેથી ખાતાવાર જે તે કર્મચારીઓને જે તે ખાતામાં ચાલતા કામ અનુસાર કામગીરી કરવાની રહે છે. પરંતુ સામાન્ય રીતે કર્મચારીઓને તેઓની કેડર અનુસાર કામગીરી સોંપવામાં આવે છે ત્રીજી શ્રેણીનાં કલાર્કને તેમની કેડરને અનુરૂપ કામગીરી તેમજ બીજી શ્રેણી કલાર્કને તેમની કેડરને અનુરૂપ કામગીરી સોંપવામાં આવે છે, જુદા જુદા ખાતામાં જુદા જુદા પ્રકારની કામગીરી જે-તે કર્મચારીને સોંપવામાં આવે તે જે તે કર્મચારીએ વિના સંકેરે સ્વીકારી લેવી જોઈએ. તે તેમની પ્રાથમિક ફરજ છે અને જે બાબતમાં કર્મચારીને સમજ ન પડે અગાર તો અજાણ હોય તો તે બાબતનું માર્ગદર્શન કર્મચારીએ ઉપરી અધિકારી તરફથી મેળવી લેવું જોઈએ અને બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની વિસંગતતા ઉભી ન થાય તથા સહજ અને સુગમ રીતે કામગીરી થાય તેવો કર્મચારીએ પ્રયત્ન કરવો જોઈએ અને એવો અભિગમ રાખવો જોઈએ.